Essen Speciality Films Limited

Formerly known as Essen Speciality Films Private Limited Regd. Office Survey No. 192, Plot No. A, Industrial Area, Behind Orchev Pharma, Website: www.essenspeciality.com Veraval (Shapar), Rajkot - 360 024 CIN : L24224GJ2002PLC041119 Guiarat - India

Phone : +91 98253 12701 E-mail : info@essenspeciality.com GSTIN : 24AABCE2983N1ZC



October 29, 2024

To,

National Stock Exchange of India Limited The Listing Department Exchange Plaza, C-1, Block - G, Bandra-Kurla Complex, Bandra (East), Mumbai - 400 051

NSE Symbol: ESFL

- Subject: Submission of Newspaper clippings of Extracts of Financial Results for the quarter and half-year ended September 30, 2024
- Regulation 47 of the Securities and Exchange Board of India (Listing **Reference:** Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI Listing **Regulations**")

Dear Sir/ Madam,

With reference to the captioned subject and pursuant to Regulation 47(1)(b) and 47(3) of SEBI Listing Regulations, please find enclosed copy of newspaper clippings of Extracts of Unaudited Standalone Financial Results for the quarter and half-year ended September 30, 2024 which has been published today i.e. Tuesday, October 29, 2024 in following newspapers:

- 1. "Economic Times" English Language Daily
- 2. "Navgujarat Samay" Gujarati Language Daily

Copy of newspaper clippings shall also be available on the website of the Company at https://www.essenspeciality.com/investorszone.html

We request you to kindly take the above information on record.

Thanking You. Yours Faithfully, For, ESSEN SPECIALITY FILMS LIMITED

Pallav K. Doshi **Chairman and Whole-time Director** DIN: 02542047

Encl: a/a

Economy: Macro, Micro & More 15

MONTHLY ECONOMIC REVIEW

Outlook Bright,

PLUS POINTS Stable external sector, positive

farm prospects, chances of higher govt spend

WITH GOVT PLANNING TO USE ₹76.000-CR BUILDING CESS KITTY... Pension in Works for 8.5 m Construction Workers

Move guaranteeing social security requires update of BOCW Act, 1996; ministry banking on e-Shram for data

Yogima Seth

Vogima Sett New Delhi: The government is multiling over using the 75,000 cro-and construction workers' coss to and construction workers' coss to these unorganised workers after the ago of 0 years. The move is aimed at providing social security to these workers after social security to these workers after social security to these workers after amendment to The Building and other Construction Workers (BOCW) Act, 1996, said people awa-root the deliberations. The labour and employment mi-sing the social security en-gaged in building and other constru-tuction works. So for now, only half of the building and other constru-tion workers are enrolled with the state welfare boards and the remain

BOOST FOR AFFORDABLE HOUSING SECTOR

Budget Home Threshold

may be Hiked to ₹55 lakh



ning are deprived of all benefits under thescheme. "Besides, the ministry could in troduce a pan-india card for const-truction workers to allow portains." The ministry is also considering ruction workers to allow portains and any with a mandatory re-ty of benefits to these workers, who constitute a huge part of indust to work these first outer thesche-

1996; ministry banking on e-Shram for data me, according to the person, and plans to simplify registration. States of the processes invol-ted while enrolling so that state welfare boards, are mandated to frame and implement schemes to the state welfare boards, are mandated to frame and implement schemes to the state scheme. The base is the scheme. The ministry is banking on the show order is banking on the sh

CENTRE ISSUES FRESH DIRECTIVE Power Discoms to Follow **Uniform Accounting Rules**

Anuradha Shukla

Anuradha Shukia New Delhi: The group of mi-nisters (GM) tasked by the Group to hock invices placeton of CST for real estate is of the view that the definition of af-fortable housing be exten-ded to SS lack from the cur-rent \$51 lakk, people in the KT and the additional tasks of the The state of the state of the The state of the state of the the state of the state of the state of the state of the fordable housing sector. Currently alfordable hou-sing attracts GST of 18, while levied 5%. The input tax cre-dit (TTC) facility is not avai-lable in both cases.

lable in both cases. The seven-member GoM headed by Goa chief mini-ster Pramod Samant may al-so recommend enhancing tax on luxury housing abo-ve ti5 corre and may not give our which to hold the other ve tis crore and may not give any relief to joint develop-ment agreements (JDAs) on the application of GST. "There was a general con-sensus that the definition of

 Council may back change in definition
 Formation of the second secon GoM set up by GST Council may back change in definition

Essen Speciality Films Limited (Formerly known as Essen Speciality Films Private Limited)

Regd. Office : Survey No. 192, Plot No. A. Industrial Area, Behind Orchev Pharma, Veraval (Shapar), Rajkot, Gujarat - 360024, India Contact : + 9) 98253 12701 [E-mail : compliances@essensecially.com Website : www.essenspecially.com | CIN : L24224GJ2002PLC041119



EXTRACTS OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF-YEAR ENDED SEPTEMBER 30, 2024

Sr. No.	Particulars	Quarter Ended 30.09.2024 (Unaudited)	Half-Year Ended 30.09.2024 (Unaudited)	Quarter Ended 30.09.2023 (Unaudited)
1				
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items#)	694.68	1,016.64	548.68
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	694.68	1,016.64	548.68
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	548.28	784.99	410.66
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	548.28	784.99	410.66
6	Equity Share Capital	2,069.92	2,069.92	2069.92
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			
8	Earnings Per Share (Face Value of Rs.10/- each)			
	Basic	2.65	3.79	2.01
	Diluted	2.65	3.79	2.01

Notes

Veraval (Shapar) October 28, 2024

1. The above is an extract of the detailed format of Financial Results for the guarter and half-year ended September 30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the websites of the National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company at https://www.essenspeciality.com/investorszone.html.

2. The Unaudited Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on October 28, 2024.

3. These financial results have been prepared in accordance with the applicable with Accounting Standard ("AS") as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 7 of the Companies (Accounts) Rules. 2014

> Pallav K Dosh Chairman & Wholetime Director DIN: 02542047

but Demand Needs **Monitoring: MoF**

Twesh Mishra

New Delhi: The Centre has in New Delhi: The Centrohasin-structed all power distribu-tion companies (discoms) to adopt uniform accounting practices, with an aim to pre-vent financial misreporting. The firsh directive, issued ear-lier this mouth, seeks disclo-sures over and above those specified under the Indian Ac-counting Standard. These in-clude details of revenue from sale of energy number of con-sultant of energy number of con-summa meet good of suppr-ing overnment offices and cross-subsidy from move is al-Is number of prepaid meters in government offices and cross-subsidy. The move is ai-med at curbing the ability of the discomes to create regula-tions are applied on the second people familiar with the mat-ter" It will help in better as-sessing credit ratings of dis-coms from financial state-ments", said an official, who didnot wish to be identified. According to the proven ma-moveided in the tariff orders nistry directive, any sum not provided in the tariff orders will not be recognised as re-venue or income recoverable from future tariff in the fi-



astructure and Development (NaBFID), set up under the NaBFID Act, 2 untry. The entity is regulated and supervised as an All-India Financial In oised to play an extremely crucial role in supporting infrastructure funding and development of bond and derivatives markets and promoting best p infrastructure financing in the course Bank of India (RBI). NaBFID is poi innovative financing instruments a ng by driv

Sr No	Post / Grade Vice President - Accounts			
1				
2	Vice President - Corporate Strategy, Partnerships & Ecosystem Development (TAS)			
webs 2. Refe 3. Any a	sligbility criteria (age, experience, job profile etc.) and other details, please visit the Bank's ite https://mabfid.org/careers or scan the QR code. detailed advertisements to ensure eligibility and other details before applying. addendum / corrigendum / modification in this regard will ONLY be available on the Bank's website. citon will be solely at the discretion of the Bank and its decision will be final. Please refer to https://mabfid.org/careers for more details.	¥di∎ A		

INDIA CC

at GIFT IFSC, GIFT City, Gandhinagar, Gujarat. It acts as a ed (India INX). India INX offers investors 22 hours trading in INVITES APPLICATIONS FOR THE POST OF DIRECTOR & CHIEF EXECUTIVE OFFICER (MD & CEO)

ATION: GIFT IFSC. GIFT City, Gandhinagar, Guiarat (India)

email their CVs along with a photos

All applications will be held in strict confidence and should be received by midnight IST on November 18, 2024. Only complete appl the given timeline only will be considered. All queries and clarifications may please be directed to mdceo_indiaicc@transearchindia hsite: www.indialcc.com

For more information, log on to www.ptcindia.com Gaci



ગઢડાવ

વડાપ્રધાને કાકલો રોકાવી દિચાએ

બનાવેલા ચિત્રો ભેટરૂપે સ્વીકાર્ચા

ਨਗ ਵਿਗਲੇ ਯੁੱਕੇ ਹਨਪੁੰਗਕਰੇ ਰੇਸ਼ਗ ਹਿਕੀਰੀ ਵੱਸ ਲੇਣ ਆਪੀ ਨਹੀਂ ਕੇਰੇ

મહાનુભાવોએ સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી.

મહાલુભાવોને આવકારવા આર્ટિસ્ટ એવી દિવ્યા વિગ્ને લઇ રોડ શોમાં ઉભી હતી અને બન્ને વડાપ્રધાન વેને મલ્લા હતા. વડોદરા ચહેરની એમ એમ

શહેરની એમ.એસ

बैंक ऑफ़ इंडिया Bank of India BOI

ા કેશવલાલ હેમસંદદાસ ને શ્રીમતી મંજુલાબેન શવલાલ પંચાલ ખાઃ ન્યુ કલોચ માર્કેટ

95

Notes

Veraval (Shapar) October 28, 2024

સુરતમાં તહેવારો અકસ્માતગ્રસ્તઃ કોલેજિયન યુવક, રત્નકલાકાર સહિત ચારનાં કરૂણ મોત

PIRCSIC

🔜 સુરત શહેરમાં દિવાળી ટાણે વાહન અકસ્માતના બનાવોમાં વધારો નોંધાયો છે. પડિસરા, ભેસ્તાન, સરસાણા અને કાપોદ્રામાં અકસ્માતની ઘટના સર્જાતાં ચાર વ્યક્તિઓના ગંભીર ઇજાને કારણે મોત થયા છે.

મૂળ મહારાષ્ટ્રનો વતની અને હાલમાં શહેરના ભેસ્તાનની પ્રિયંકાગ્રીન સોસાયટીમાં રહેતો 18 વર્ષીય અભય ઉર્ફે સાસાચાર્યા દેશાં 16 વર્ષા અપને અને અ બાલક્રિપ્ના મૂળચંદ નિશાદ મિત્ર નીરજ શાહ સાથે બાઈક પર ડીંડોલી ખાતે રહેતા અન્ય મિત્રને મળવા ગયા હતા. જોકે મિત્ર ઘરે નહીં હોવાથી બંને મિત્રો પરત જતા હતા ત્યારે ભેસ્તાન બ્રિજ પર બાઇક ધડાકાભેર અથડાઇ હતી. સર્જાયેલા અકસ્માતમાં બંને મિત્રોને ધાયલ અવસ્થામાં 108 મારફતે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં માથામાં ગંભીર ઇજાને કારણે

પાંડેસરા, ભેરતાન, અભ્યાસ કરતો હતો. ભેસ્તાન પોલીસે ચલાવતા હતા. તેઓ ગઈકાલે સાંજે સરસાણા અને કાપ્પોદ્રામાં ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. શ્રીનાથજી કાર્મ હાઉસ પાસે આવેલી ુ....પ્રાપ્ત પ્રચ્ય હતુર કપ હતા. શ્રાનાથજી કામ હાઉસ પાસે આવેલી બીજા અકસ્માતમાં મૂળ યુપીના બાંદા ચાની લારી પર ચા પીવા માટે ગયા હતા. જિલ્લાના વતની 45 વર્ષીય અશોકરામ ચા પીધા બાદ પરત સાઇટ પર જતા હતા ચા પીધા બાદ પરત સાઇટ પર જતા હતા દરમિયાન બેફામ દોડીને આવતા ડમ્પર ચાલકે તેમને અડકેટમાં લેતા ગંભીર ઈજાના કારણે જ સ્થળ પર મોત નીપજ્યું હતું. કાપોદ્રા પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ

> સોસાયટીમાં રહેતા 38 વર્ષીય ગિરીશ વાળાભાઈ ચુડાસમા રત્નકલાકાર તરીકે હીરાના કારખાનામાં કામ કરતા ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન બાઈક પરત વરાછા યોગીચોકથી પોઠાક પૈશા પૈશાઝા પાંગાપાંકપા પોતાના ઘરે જતાં હતા, ત્યારે તેમનો અન્ય એક બાઈક સાથે અકસ્માત નબ્રો હતો. બાદમાં માથામાં ગંભીર ઈજાના કારણે સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું ગઈકાલે સાંજે સારવાર દરમિયાન

પ્રસાદ યાદવ બે પુત્ર અને બે પુત્રી સહિતના પરિવારસાથે હાલમાં પાંડેસરા

મોત થયું હતું. મૃતક અભય ઉધનાની સિટીઝન કોલેજમાં એફ્વાય બી કોમમાં

વિસ્તારમાં આવેલા વડોદ ગામ ગણેશ નગરમાં રહેતા હતા, અને સિલાઈ કામ પરથી પગપાળા ઘરે જવા નીકળ્યા હતા. દરમિયાન પાંડેસરા કમલા ચોક પાસે અજાણ્યા વાહન ચાલકે તેમને અડફેટમાં તબીબે મૃત જાહેર કર્યા હતા. પાંડેસરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

લીધા હતા. ઘટના બાદ તેમને 108માં હતા, અને એક પુત્રી અને બે પુત્રનું સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ભરણપોષણ કરતાં હતા. ગઈ તારીખ ખસેડયા હતા. જ્યાં તેમને કરજ પરના 20 ઓક્ટોમ્બરના રોજ બપોરે પોણા

કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ગુનો નોંધ્યો છે. અશોકરામ ગઈકાલે રાત્રે સાડા આઠ ચોધા અકસ્માતમાં વરાછામાં વાગ્યાના સમયગાળા દરમિયાન નોકરી એલ. એચ. રોડ પર આવેલા નીલકંઠ

ત્રીજા અકસ્માતમાં મૂળ મધ્યપ્રદેશના જાંબુઆના વતની 30 વર્ષીય માનસિંહ બાબસિંહ મનિયા હાલમાં શહેરના

એસેટ રીકવરી ડિપાર્ટમેન્ટ

บห้อเส สโอโล

(સ્થાવર મિલકતો માટે

લેની નીશે જણાવેલ બિલક

સ્થાવર મુકેલ મિલકતનું વર્ણન

નલિખિત મિલકતો સંબંધિત કોઈ વ્યવહાર ન કરે અને આવો કોઈપણ વ્ય આબુસંગિક ખર્ચા, કોસ્ટ, ચાર્જીસના બેંક અં ગાવે છે કે મુકરર મિલકતો છોડવવા માટે સમય

તી કલમ ૧૩(૧૨) અ

કીચ સઠાચ માટે અ

શેટ્સ એન્ડ ર મળશે મળેલી ર

બાબુાસહ બુાવવા હાલમાં શહરવા કડોદરા સ્થિત શ્રીનિવાસ સોસાયટીમાં ત્રણ સંતાનો સાથે રહે છે, અને કાર્પોદ્રામાં ગિરનાર રોડ પર શ્રીનાથજી

ફાર્મહાઉસની બાજુમાં ચાલતી બાંધકામ મોત નીપજ્યું હતું. પોલીસે ગુનો નોંધી સાઇટ પર કામ કરી પરિવારનું ગુજરાન વધુ તપાસ શરૂ કરી હતી.

બેંકની ઝણ સગવડ અંતર્ગત નીચે જણાવેલ તા

ESSER

(Rs. in Lakhs except EPS

નજરકદ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોંગ્રેસના આગેવાનોને પણ નજરકેદ કરાયા હતા. કેટલાકની અટકાયત કરવામાં આવી હતી. કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ સહેડને ગઈકાલે ભપોશ્થી જ પોલીસ પ્રોકોટેશન હેઠળ રાખવામાં આવ્યા ચારના ગમ. અસે . કરતી વિદ્યાર્થિની દિવા ગોસાઇ ઉત્તમ ચિત્ર કલાકાર છે. તે તેમના પરિવનો સાથે બંને વડાપ્રધાનના ગમતે દોરેલા દિગ્રાની ફેમ સાથે માર્ગ ઉપર ગોઠવાઇ પ્રક્ષ હતી અપ હતા. જેથી તેઓ કોઈ પોચામમાં જઈ એજન્સીઓએ વાહન વ્યવહાર બંધ કરી मा शहे દીધો હતો અને તેના કારણે આજે સવારે સાથે બન વડોપ્રદોનનાં જત દારેલા પ્રશ્નાનાં કુમ સાથે માંગ ઇપર ગાઢવાછ છા હતી અને મહત્વુભાઓના આગમનાનાં આત્રુદ્ધતા પૂર્વ કાર ખેતી જેવા મળી હતી. એવામાં રોડ શોનો કાકલો આ તરફથી પસાર થયો અને તેવામાં બન્ને વડાપ્રધાનની નજર આ છાંગ પર ગઇ હતી. તેથી આ આખો કાફલી કોરી દેવામાં આવો હતો. બન્ને મહત્વુનાવો પોતાની પૂર્વ્યુ વિપ્રધાંથી નીચે હિતર્ચા હૂતા અને આ દિવ્યાંગ છાંગાને મળવા તેમની પારે પહોંચી ગયા ટાટા એરબસના પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના લોકોને રવિવાર રાતથી જ નોકરી ધંધા પર જનારા લોકો હેરાન થય હતા. દર વખતે જ્યારે પણ વડાપ્રધાન મોદી વડોદરા આવે છે ત્યારે પોલીસ અને સરક્ષા નજરકેદ કરી લેવામાં આવ્યા હતા.આ ૨ટ પર સોસાયટીઓના ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા.જ્યાં ગેટ નહોતા ત્યાં પોલીસ કર્મીઓને ઉભા કરી દેવામાં આવ્યા હતા. એજન્સીઓ વડોદરાના લોકોને સુરક્ષાના નામે બિન જરુરી હેરાન કરે છે.આજનો

સુરક્ષાના કારણોસર અડધા શહેરમાં વાહન વ્યવહાર બંધ કરાયો, નોકરિયાત વર્ગ હેરાન થયો વડોદરામાં PM મોદી, સ્પેન PMના રોડ-શોથી

સોસાચટીઓના લોકો નજરકેદ થતાં નારાજગી

આગેવાનો પણ નજરકેદ

થાય તે માટે કરણી સેનાના પ્રવક્તાને નજરકેદ કરવામાં આવ્યા હતા. અ

કોંગ્રેસ સહિતના

લોકો સવારે દૂધ અને શાકભાજી લેવા માટે પણ ઘરની બહાર નિકળી શક્યા ન હતા.



નવગજરાત સમય > વડોદરા

🔳 પીએમ નરેન્દ્ર મોદી અને સ્પેનના પેડો સાન્ચેઝ વડોદરાની રાષ્ટ્રપતિ યુલાકાતે હતા. જેઓના કાર્યક્રમના કારણે ટાટા-એરબસ પ્લાન્ટના રુટ પરની સેંકડો સોસાયટીઓના હજારો લોકોને કલાકો સધી નજરકેદ જેવી સ્થિતિનો સામનો કરવો દિવસ પણ અપવાદ નહોતો. પડયો હતો. વડોદરાના અડધા ઉપરાંત પીએમ મોદી અને સ્પેનના પીએમ શહેરમાં આજે પોલીસ સહિતની સુરક્ષા સાન્ચેઝના એક કલાકના કાર્યક્રમ મોટે

બોનસ બાબતે તકરાર

નવગુજરાત સમય > વડોદરા

થઇ અને 11.75 લાખની ચોરીનો પ્લાન ઘડ્યો

🔲 વડોદરાના આજવા રોડ સ્થિત

નવજીવન સોસાયટીમાં કંપની માલિકના પરિવારને હથિયારધારી લૂંટારૂઓએ

બંધક બનાવી સોના-ચાંદીના દાગીના

અને રોકડ મળી કૂલ રૂ. 11.75 લાખની મત્તાની લૂંટ કરી ફરાર થઇ ગયા હતા.

આ ઘટનાને અંજામ આપવા ટોળકીએ

પહેલા તો ઇકો કાર ચોરી કરી અને બાદમાં

લૂંટના સામાનની ભાગ બટાઇ કરવા

રિક્ષામાં સાવલી પહોંચ્યાં હતા. જોકે ભાગ

» પાણીના ટેન્કર મામલે

બલેન્ડિયા ગામના પૂર્વ

સરપંચના પિતા સામે

કરિયાદ નોંધાઈ

વડોદરામાં બંગલામાં પરિવારને બંધક બનાવી લુંટ ચલાવનાર ગેન્ગનો પર્દાફાશ, પાંચ લુંટારા ઝડપાયા » માલિક સાથે દિવાળી

ક્રિસનવારી વિસ્તારમાં રહેતા આકાશ કહાર અને હિતેષ તડવીને તેઓનાજ મિત્ર ભૂપેન્દ્ર ઉર્ફે ભોલા પરમારે ટીપ

આપી હતી કે, નવજીવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં ખુબ મોટી માત્રમાં સોના-ચાંદીના દાગીના અને

રોકડ છે. જેથી આકાશ અને હિતેષે ભેગા

મળી આ ટીપ અજય મારવાડીને આપી હતી. અજય મારવાડીએ પોતાનુ શેતાની

દિમાગ ચલાવી ગેંગના તેના અન્ય

સાગરીત જશપાલસિંગ, મલીંદરસિંગ, અજયસિંગ અને આઝાદસિંગને જણાવી

જાનથી મારી નાખવાની ધમકી આપત

પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલકુમારી વાઘેલાએ ચાકલીયા પોલીસમાં લેખિત

કરિયાદ આપતા ખળભળાટ મચી જવા

લૂંટનો પ્લાન ઘડ્યો હતો.

બટાઇમાં વાંધો ઉભો થયો અને આખો લૂંટ કરવા માટે પહેલા આ ટોળકીએ ક્રાઇમ સીન વડોદરા ક્રાઇમ બ્રાન્ચને એક ઇકો કારની ચોરી અને ત્યારબાદ

દાહોદના જિ. પં.ના પૂર્વ મહિલા

પ્રમુખને ધમકી આપ્યાની રાવ

ક્રાઇમ બ્રાન્ચની ટીમે 11.75 લાખની શોધખોળ હાથ ધરી છે.



લગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમઘવાર સંચાલિત ચુલિ. શાળાઓને સ્માર્ટ (અનુપમ) શાળા બનાવવા અંગે ઓનલાઇન ટેન્ડર મંગાવવામાં આવે છે. અ કામના ટેન્ડરો તા. ૨૯-૧૦-૨૦૨૪ થી તા. ૧૯-૧૧-૨૦૨૪ સુધી સાંજે ૫.૦૦ આના હરુરા તા. પર-૧૦-૧૯૩૯ ના તા. ૧૯-૧૧-૧૯૭૬ તુવા તારે 4.00 કેલ્લા સુધી બે બરા પોર્ટી http://iender.aprocure.com પિયરથી ઓનલાધીન ભરવાના સ્ટેલે. ટેક્લીકલ બીડ, 1/ સમેમ.ડી. તથા ટેન્ટર કી (વુબર, ટ્યાલ, રજીસ્ટર એ.ડી., સ્વીડ પોસ્ટ, કુટીયર) તા. ૧૯-૧૧-૨૦૨૪ તા રોજ સાંજે ૫.૦૦ ડલાક સુધીમાં વિપરોક્ત સરબામે રાન્ગા દિવસો વિપાલ સ્વીકારવામાં આવશે.

-/સિન્ટ શાસનાધિકારી



દાવાદ-૭ (ઓ ગસ્કીમ નં.૭ ઉપર શ્રી મ સદરહુ સોસ ા જેનો પ્લોટ ચો.મી.(મ્યુ ટે સ્તાના

VIVEK C. MODI, Advocate M. 95 1212 6968. OFFICE: Block No. C/16, 3" Floor, Radhe Shopping Mall, Nr. Khokhara Circle Maninagar (East), Khokhara, Ahmedabad, Gujarat-380008.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ દર્શન ભવન, 36 તુઘલકાબાદ ઇન્સ્ટિટ્યૂશનલ એરિયા

આઇસીપીઆર ફેલોશીપ- 2024-25 માટે અરજીઓ મંગાવવામાં આવે છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ ફિલોસોફિકલ રિસર્ચ દ્વારા ફેલોશીપ બેચ-2024-25 ાંગુ કાળમાંચ બાત વ્યવસાયરું પર પ્લય કાળ આપા ૧૧૧૦૦૧-૦ માટે કિલોસોરી અને તેની સાથે સંકળાયેલી વિશાશાખાઓના ક્ષેત્રમા સંશોધનલક્ષી અને લાયક વિદ્વાનો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. કેલોશીપ, લાયકી ધારા-ધોરણો, સૂચનાઓ, અભ્યાસક્રમ અને અરજીપત્રક સંબંધી વિગતો કાઉન્સિલની વેબસાઇટ www.icpr.in ઉપર જોઇ શકાશે સપથા (વગતા કાઇપસલમાં વખસાઇટ www.cpr.m ઉપર જાઇ શકાય. ઓનલાઇન કોર્મને સુપરત કરવાની છેલ્લી તારીખ 20-11-2024ના રોજ 2.3.59 કલાક સુપીની રહેશે. આ પ્રક્રિયા સકળતાપૂર્વક પૂર્ણ થયા બાદ 25-11-2024 સુપી અરજીપગ્રકની એક નકલ અને તેની સાથે શૈક્ષણિક દસ્તાવેજો આઇ સીપીઆર નવી દિલ્હીને મોકલી આપવાના રહેશે જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોએ રૂ. 500ની ફી ઓનલાઇન ભરવાની રહેશે, જ્યારે એસસી/એસટી અને પીડબલ્યુડી કેટેગરીના ઉમેદવારોને રૂ. 200ની ફી ભરવાની રહેશે. આ ફેલોશીપ માટે કોઇએ અરજી ના કરી હોય તેમ છતાં તેને ફેલોશીપ

હાથે લાગતા કુલ પાંચ લોકોની ધરપકડ 20 ઓકટોબરની વહેલી સવારે ત્રણ લૂંટના મામલામાં અજય રમેશભાઇ ડરવામાં આવી છે. જ્યારે શિકલીગર વાગે આ ગેંગ નવજીવન સોસા.માં મારવાડી, સહુલ પરશોત્તમ સોલેડી ગેંગના હજી ચાર આરોપીઓ કરાર છે. રહેતા અશોકકુમાર જપપ્રકાશ સિંધલના હિતેષ તડવી, આકાશ કિશોરભાઇ સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના બંગલામાં ત્રાટકી હતી.ઇકો કાર હાઈવે કહાર અને ભૂરેન્દ્ર ઇફેં ભોલા દેવજભાઇ પર ભિના સાથે છે. પર ભિનારસી છોડી આ ટેળથી રહ્યુ હતા પરમારની પરંપક કરી ટ. 2.0 લાખનો સોલંકીની રિક્ષામાં બેસી સાવલી પહોંચ છે. મુદ્દામાલ જન્ત કર્યો છે, જ્યારે શીકલીગર જ્યાં લૂંટના સામાનની ભાગ બટાઇ વખતે ગેંગના જરાપાલસિંગ, મલીંદરસિંગ, માથાકુટ થઈહતી. પોલીસે આમ વડોદરા અજયસિંગ અને આઝાદસિંગની

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સ્કાઉટભવન, પીટી કોલેજની બાજુમાં, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૦૭.



આથી સા ઇપણ પ્રકા પ માં પ્રમા કોઇન

એમ.બી રોડ, નવી દિલ્હી, 110062

આપવાનો કાઉન્સિલ પાસે અબાધિત અધિકાર રહેશે

ခံသင်းလားကို ကို ကို ကြောက်ကို ကျောက်ကို ကျောက်ကောက်ကို ကျောက်ကောက်ကောက်ကောက်ကောက်ကောက်ကောက် શ્રી જગદીવરુભાઈ ડુંગરજમાં રેલિયાની નામની સ્થાયર ભિલ્કત સમૃષ્ઠિત રોડ નં... ભે/(દૂર રહીય) જોના એરિશા સેપ્ટલા ૨૮. ૧૩ સે તેરાંદર્શ દેવ આપી લેક નામને પાછીલી કલીમ અને આઇભાશુત છોના એરેબેનિટીસ સાથે સેરકાલ ૨૮.૧૨ સે ગોટાંડે જોનાન ભાઈન કુ ચે તે... ત્યાણી ભાંગ પાછે બિલ્લાએલાક પગોના એરિશા સેક્ષલા વરલર સે એરિટર, દી.પી. સ્થીમ નં. ૧૫ (દાઠવા સિંગરલા – ભૂલાડડી) અને ફાઇલલ પછે નં. ૩૧(કૂલ ભોલોકીલક બિલ્બોલોલાક વર્ષોના કો સેંગલ્ય વકલ્ય, કરો આને કોર્ય રહવા (ફા.) ૨૫. ૧,૧૨,૦૦,53૧.5૯/-(ફા. એક કરોડ બાર લાપ છસ્સો એકત્રીર અને સડસઠ પેસા ફક્ત) ચડત વ્યાજ સાથે માલકો) એએ ફોર્મિયલ વ્યાદ એ. કપુર વૃષ્ણ આવાનાકા માને આવતા દારાક્ષે કુ શ્કે મીટલે ગામ / મોપે કહવાડા માતે આવેલ અને સ્થિત, વાલુકા: દસ્સોમે (ડેસ રજીસ્ટ્રેશન સબ ડિસ્ટ્રીક્ટ: આમદાવાદ – ૧૨ (નિકોલ) ખાતે આવેલ સમગ્ર : ઉત્તરે: શેડ નં. બી/દ્વ, દક્ષિણે: શેડ નં. બી/પર, પૂર્વે: શેડ નં. બી/૩૧, પશ્ લદ્દ સ્કે.મીટર્સ ગામ / મોજે કઠલ મને ગળકરેવાન સલ્દ દિસ્ટીદર ેની ચર્ત:સીમા માંટર આપદીર રોટ. રહેલાંક બુલે એ નેન્ડર સેંગઠળ આપટે પર ગર સે તીરાંગે સાથે તેના પર રહેલાંક બુલે એ નેન્ડર સેંગઠળ આપટે પર ગર સે તીરાંગે સાથે તેના પર રિટિપ્ટે આપવા છે. તેમ આપવા છે. સિંદા પ્રચાર પર ગર સે તે પ્રચાર રિટપ્ટે આપવા છે. તેમ આપવા છે. તેમ આપવા છે. તેમ આપવા છે. સિંદા ગે આપવા છે. તેમ આપવા છે. તેમ આપવા છે. તેમ આપવા છે. સિંદા ગે સેમ આપવા છે. તેમ આપવા છે. તેમ આપવા છે. તેમ આપવા છે. સિંદા ગે સેમ આપવા છે. તેમ આપવા છે. સિંદા ગે સેમ આપવા છે. તેમ આપવા છે. આપવા છે. તેમ આપવા છે. ૦૧.૦૮.૨૦૨૪ ફા. ૧૫,૩૭,૪૨૨.૯૦/-(ફા. પંદર લાખ સાડત્રીસ હળાર ચારસો બાવીસ અને શિત્તેર પૈસા કસ્ત્) સડત અંદી/- અધિકૃત અધિકારી હોંક ઓક શંતિક

Essen Speciality Films Limited

(Formerly known as Essen Speciality Films Private Limited) Regd. Office : Survey No. 192, Plot No. A. Industrial Area, Behind Orchev Pharma, Veraval (Shapar), Rajkot, Gujarat - 360024, India Contact : +91 98253 12701 | E-mail : compliances@essenseciality.com Website : www.essenspeciality.com | CH : 124224GJ2002PLCd41119

> EXTRACTS OF UNAUDITED STANDALONE FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF-YEAR ENDED SEPTEMBER 30, 2024

Sr. No.	Particulars	Quarter Ended 30.09.2024	Half-Year Ended 30.09.2024	Quarter Ended
		1	Total income from operations	4,630.83
2	Net Profit/ (Loss) for the period (before Tax, Exceptional and/ or Extraordinary items#)	694.68	1,016.64	548.68
3	Net Profit/ (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items#)	694.68	1,016.64	548.68
4	Net Profit/ (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items#)	548.28	784.99	410.66
5	Total Comprehensive Income for the period [Comprising Profit/ (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]	548.28	784.99	410.66
6	Equity Share Capital	2,069.92	2,069.92	2069.92
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year			
8	Earnings Per Share (Face Value of Rs.10/-each)			
	Basic	2.65	3.79	2.01
	Diluted	2.65	3.79	2.01

There were no Exceptional and/ or Extraordinary items during the Quarter and Half-year ended September 30, 2024

1. The above is an extract of the detailed format of Financial Results for the guarter and half-year ended September 30, 2024 filed with the Stock Exchanges under Regulation 33 of the SEBI (Listing and Other Disclosure Requirements) Regulations, 2015. The full format of the Financial Results is available on the websites of the National Stock Exchange of India Limited at www.nseindia.com and on the website of the Company at https://www.essenspeciality.com/investorszone.html.

2. The Unaudited Financial Results have been reviewed by the Audit Committee and approved by the Board of Directors at their respective meetings held on October 28, 2024.

These financial results have been prepared in accordance with the applicable with Accounting Standard ("AS") as prescribed under Section 133 of the Companies Act, 2013 read with Rule 7 of the Companies (Accounts) Rules, 2014.

> Pallay K Do Chairman & Wholetime Di DIN: 02542047

» ખોટા દસ્તાવેજો બતાવી નાણાં લઈ કરમસદમાં મકાન આપવાના બદલે

હાથ અદ્ધર કરી દીધા **નવગુજરાત સમય** > આણંદ

🔳 આશંદના કરમસદમાં અધિરાજ બંગલાની સાઈટ મુકી આશંદમાં રહેતા તથા મોગરીમાં રહેતા ત્રણ શખ્સોએ ભેગા મળી પોતાના ખાસ એનઆરઆઈ મિત્રને ખોટું બ્રોશર અને ખોટા નકશા બતાવી 3 2 02 કરોડની રકમ લઈ લીધી હતી બાદમાં પુરો દસ્તાવેજ નહીં કરી આપી અને જગ્યા પડાવી લઈ ધમકીઓ અપાતા આણંદ શહેર પોલીસ મથકે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આણંદના અનંત પટેલે ફરિયાદમાં

જણાવ્યું છે કે તેમના મિત્ર પરીમલ ભગવત પ્રસાદ પટેલ 20 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયેલા છે. આણંદ મોતીકાકાની ચાલી પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા ચિંતન પટેલ વિરધ્ધ કરિયાદ નોંધાવી હતી.

જિલ્લા પંચાયતના સભ્ય શીતલકુમારી નવગજરાત સમય > દાહોદ વાઘેલાએ આ મામલે જણાવ્યુ હતુ કે, બલેન્ડીયા ના ગ્રામજનોએ પીવાના ટેન્કરની જરૂરિયાત માટે વાત કરતા મેં દાહોદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ઞને વાધેલા જિલ્લા પંચાયતના સભ્ય શિતલકમારી વાઘેલાને જાનથી મારી તલાટી કમ મંત્રીને પૂછપરછ કરેલ કે ધારાસભ્યશ્રી દ્વારા વર્ષ 2019-20 માં નાંખવાની ધમકી મળતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બલેન્ડીયા ગામના ટેન્કરની ફાળવણી કરેલ હતી તે ટેન્કર ક્યાં ગ્રામજનોએ પીવાના પાણીનં ટેન્કર

પામ્યો છે

છે તો તલાટીએ જવાબ આપવામાં ગલ્લા મળે તે માટે ગ્રાન્ટની માંગણી કરી હતી. તલ્લા કર્યા હતા ત્યારબાદ બે દિવસ બાદ તેમા જણાવ્યું હતું કે વર્ષ 2019/20 માં પૂર્વ સરપંચના પિતા સુરેશ કિશોરીએ ઝાલોદના ધારાસભ્યે ટેન્કરની ફાળવણી મને ફોન કરીને તું ટેન્કરની કેમ માહિતી માંગે છે તેમ કહી અને જાનથી મારી કરી હતી અને બલેન્ડીયા ગ્રામ પંચાયતમાં નાખવાની ધમકી આપી હતી. આ બાબતે મેં ચાકલિયા પોલીસ મથકે લેખિતમાં પણ ફાળવેલ છે. જે બાબતની તલાટીને પૂછપરછ કરતા ગ્રામ પંચાયતના પૂર્વ મેં ચાકલિયા પોલીસ મથકે લેખિતમાં સરપંચના પિતા સુરેશ કિશોરીએ કરિયાદ આપી છે તેમજ સરકારી ટેન્કર શીતલ કુમારી વાયેલાને શેન કરી તું પૂર્વ સરપંચના પિતા પોતાના અંગત કેમ ટેન્કરને પૂછપરછ કરે છે. તેમ કહીને ઉપયોગ માટે વાપરે છે.

આણંદના બિલ્ડરે ₹2 કરોડ લઈ NRI મિત્રને મકાન નહીં આપતાં ફરિયાદ

ધીરજલાલ સંઘવી તેમના મિત્ર છે. વર્ષ

2020માં ચિંતને પરીમલભાઈને ફોન કરી કરમસદની સ્ક્રિમના બ્રોસર અને પ્લાન વોટ્સઅપથી મોકલ્યા હતા. જેમાં પ્લોટ નં. 4 પરીમલભાઈને પસંદ પડ્યો હતો. ત્યારબાદ 10-1-2021ના રોજ મેમોરેન્ડમ ઓફ અંડર સ્ટેન્ડીંગ બનાવ્યું હતું અને તે મુજબ કુલ રૂ. 2020000ની રકમ ચિંતન સંઘવીને આપી હતી, વધારાના રૂ. 23 લાખ પણ તેમણે લીધા હતા. થોડા સમય પછી ચિંતને કહ્યું અહીયાં જંત્રીના ભાવ બમણા થશે એટલે તમારે વધારે કેપીટલ

ગેઈન ટેક્ષ તથા અન્ય વ્યવહારો વધી જશે

એટલે દસ્તાવેજ કરી લો. જેથી તા.10-8-2022ના રોજ સાંજે 4 વાગે રજીસ્ટ્રારની

કચેરીમાં દસ્તાવેજ થયો હતો. જોકે તેમાં

મેમોરેન્ડમ મુજબ 6099 ચો.ફૂટનો પ્લોટ ન હતો. વધારાની જમીનનો દસ્તાવેજ તેમને

કરી આપ્યો ન હતો. જેથી પરીમલભાઈના

કહેવાથી અનંત પટેલે ચિંતન સંઘવી તેમની માતા લીનાબેન અને મોગરીના કિશન

નવગજરાત સમય > સરત